

લિંબાયત પો.સ્ટે.ના હત્યાની કોશીષના ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી,
સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેરના લિંબાયત પો.સ્ટે. વિસ્તારમાં રતન ચોક ખાતે બે કેટીવા મોપેડ ઉપર નરેન્દ્ર ઉર્ફ કબૂતર પાટીલ તથા હર્ષદ ઉર્ફ બારીક પાટીલ તથા જગદીશ ઉર્ફ ચકલી અને અજય ઉર્ફ અજયા પાટીલ નાઓએ એકબીજાના મદદગારથી ધર્મેશ ભાસ્કર નામના ઇસમને બીભત્સ ગાળો બોલી પોતાની પાસેના ચપ્પુ વડે ફરીયાદી ધર્મેશને છાતી તથા પગના ભાગે ગંભીર જીવલેણ ઇજા કરી નાશી ગયેલ જે બાબતે લિંબાયત પો.સ્ટે. ફસ્ટ A-૧૧૨૧૦૦૨૫૨૦૦૦૬૯૭ ઇ.પી.કો. કલમ ૩૦૭, ૨૯૪(ખ) ૧૧૪ જી.પી.એક્ટ ૧૩૫(૧) મુજબનો ગુનો નોંધાયેલ હતો. જેમા લિંબાયત પોલીસ અગાઉ બે આરોપીઓની ધરપકડ કરેલ હતી જે ગુન્હામાં બીજા આરોપીઓ નાસતા ફરતા હોય જે શોધી કાઢવા પો.સ.ઇ. વી.વી.ભોલા તથા તેઓની ટીમના એ.એસ.આઇ. વિજયસીહ બહાદુરસીહ તથા અ.હે.કો.રાઘવભાઇ કરશનાભાઇ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પર્વત પાટીયા ઓવરબ્રીજ નીચે જાહેર રોડ ઉપરથી આરોપી હર્ષદ ઉર્ફ બારીક S/O સુનીલભાઇ પાટીલ ઉ.વ. ૩૦ રહે. ધર નં. ૧૫૦, રતનચોક સાંઇબાબા મંદિર સામે નવાનગર ઉધના યાર્ડ લિંબાયત, સુરત. મુળગામ-તમગાવન તા.ચાલીસગાવ જી.જલગાવ (મહારાષ્ટ્ર)વાળાને ઉપરોક્ત ગુનામા નાસતો ફરતો હોય તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે મજકુર આરોપીની પુછપરછ કરતા તેણે જણાવેલ કે ઉપરોક્ત ગુનામા નરેન્દ્ર ઉર્ફ કબૂતર પાટીલ તથા અજય ઉર્ફ અજયા પાટીલ અને જગદીશ ઉર્ફ ચકલે પાટીલનાઓ સાથે મળી પોતે પણ એક્ટીવા મોપેડ ઉપર લિંબાયત રતન ચોક ખાતે ફરીયાદી ધર્મેશ પાટીલને મારવા માટે ગયેલ અને નરેન્દ્ર ઉર્ફ કબૂતર પાટીલ અને જગદીશ ઉર્ફ ચકલી નાઓએ પોતાની પાસેના ચપ્પુ વડે ધર્મેશ પાટીલ ઉપર છાતી તથા પગના ભાગે જીવલેણ હુમલો કરતા પોતે પણ તેમની સાથે ગુનામા સહભાગી થઈ ફરીયાદી સાથે ગાળ ગલોચ કરી, ધાક ધમકી આપેલ હતી. જેમા અજય તથા જગદીશની લિંબાયત પોલીસે ધરપકડ કરેલ છે અને પોતે પોલીસની ધરપકડથી નાસતો ફરતો હતો વિગેરે હકીકત જણાવેલ છે.,
ગુનાહીત ઇતિહાસ :-આરોપી અગાઉ ઉચ્છલ પો.સ્ટે.ના લિંબાયત પો.સ્ટે. ખાતે ભારતીય બનાવટના વિદેશી દારૂનુ વેચાણ તથા હેરાફેરીના ગુનામાં પકડાયેલ છે.